

# ભારતીય જનતા પાર્ટી

## ગુજરાત પ્રદેશ

### શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

પ્રેસનોટ:૦૧

૧૧/૦૨/૨૦૨૦

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકાર દ્વારા મહિલા અનામત બાબતના પરિપત્રમાં સુધારો કરવાની કરેલી જાહેરાતને સહર્ષ આવકારી રાજ્ય સરકારને અભિનંદન આપતા પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી

ભાજપા સરકાર 'સૌનો સાથ - સૌનો વિકાસ - સૌનો વિશ્વાસ અને સૌને ન્યાય'ના સિદ્ધાંતને અનુસરીને સમાજના દરેક વર્ગ તથા જ્ઞાતિ-જાતિના હિતને ધ્યાનમાં રાખી સમાનતાથી ન્યાયપૂર્ણ નિર્ણયો કરી રહી છે

- શ્રી જીતુભાઈ વાઘાણી

કોંગ્રેસ હંમેશા વોટબેંકને નજરમાં રાખી પોતાના રાજકીય રોટલાં શેકવા માટે સમાજના જુદાજુદા વર્ગોને, જ્ઞાતિ-જાતિને ઉશ્કેરવાની નિમ્નકક્ષાની રાજનીતિ કરતી હોય છે

- શ્રી જીતુભાઈ વાઘાણી

ગુજરાત સરકાર દ્વારા સર્વસમાજના હિતને ધ્યાનમાં રાખી કોઈને પણ અન્યાય ના થાય તે રીતે તે પ્રકારે પરિપત્રમાં સુધારો કરવાની કરવામાં આવેલી જાહેરાતને ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા. પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દેશરણભાઈ બ્રહ્મભટ્ટ તથા પ્રદેશ ભાજપા અગ્રણીશ્રીઓએ હર્ષભેર આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા.

પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, આજરોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકાર દ્વારા મહિલા અનામત બાબતના પરિપત્રમાં સુધારો કરવાની કરેલી જાહેરાતને સહર્ષ આવકારી રાજ્ય સરકારને અભિનંદન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક દિવસથી એલઆરડીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ મહિલા ઉમેદવારો પોતાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા હતા. ઓબી.સી., એસ.સી., એસ.ટી. વર્ગની ઊંચા ગુણ સાથે પાસ થયેલી મહિલાઓની સરકારના એક પરિપત્ર બાબતે રજૂઆત હતી તે અંગે જે તે સમયે જ રાજ્ય સરકાર દ્વારા તે મહિલાઓને બાહેધરી આપવામાં આવી હતી કે સરકાર આ પરિપત્ર બાબતે કાયદાવિદો સાથે પરામર્શ કરી તેમજ નામદાર સુપ્રીમકોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કરી કોઈપણ વર્ગને અન્યાય ના થાય તે રીતે યોગ્ય નિર્ણય લેશે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આજે આ પરિપત્રમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને ભાજપા વતી તેમજ સમગ્ર ગુજરાતની જનતા વતી આવકારી રાજ્ય સરકારનો આભાર માનું છું.

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપા સરકારની પહેલેથી જ નીતિ રહી છે કે કોઈપણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો તેમજ તમામ લોકોને સંપૂર્ણ ન્યાય મળે તે રીતે નિર્ણય લેવો. જ્યારે કોંગ્રેસ હંમેશા વોટબેંકને

# ભારતીય જનતા પાર્ટી

ગુજરાત પ્રદેશ

શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

નજરમાં રાખી પોતાના રાજકીય રોટલાં શેકવા માટે સમાજના જુદાજુદા વર્ગોને, જ્ઞાતિ-જાતિને ઉશ્કેરવાની નિમ્નકક્ષાની રાજનીતિ કરતી હોય છે જ્યારે ભાજપા સૌનો સાથ - સૌનો વિકાસ - સૌનો વિશ્વાસ અને સૌને ન્યાય'ના સિદ્ધાંતને અનુસરીને સમાજના દરેક વર્ગ તથા જ્ઞાતિ-જાતિના હિતને ધ્યાનમાં રાખી સમાનતાથી ન્યાયપૂર્ણ નિર્ણયો કરી રહી છે.

ગુજરાત સરકાર દ્વારા સર્વસમાજના હિતને ધ્યાનમાં રાખી કોઈને પણ અન્યાય ના થાય તે રીતે ઓબીસી, એસ.સી. તથા એસ.ટી. સમાજને પણ ન્યાય મળી રહે તે પ્રકારે પરિપત્રમાં સુધારો કરવાની કરવામાં આવેલી જાહેરાતને ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા. પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી. પટેલ, શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ તથા પ્રદેશ ભાજપા અગ્રણીશ્રીઓએ હર્ષભેર આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

(પ્રશાંત વાળા)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ